

શિક્ષણ અને સમાજ
કલ્યાણ કેન્દ્રનું
માસિક મુખ પત્ર



વર્ષ : ૧૨

અંક : ૩

વહેતુ ઝરણું સમય

સમયની સમજ માત્ર માણસને જ છે. આજના યુગના માણસને સતત સમય ગુમાવ્યાનો અફસોસ રહ્યા કરે છે. સતત સમયની હત્યા કરતો રહે છે તો સામે પક્ષે જીંદગીની પળો ખુટતી જાય છે. વિશ્વ બ્રહ્માંડ સમય સાથે ઓતપ્રોત રહીને ગતિશીલ રહે છે માણસ ઘડિયાળને ચાવી દે છે ત્યારે ભુલી જાય છે કે તે પોતે પોતાને ચાવી દે છે ઘડિયાળ તો ચાવીનેય ચાવી જાય છે. સમયનો સંદર્ભ માત્ર માણસને છે. કીટ-કીટાણુ, પશુ-પક્ષીને નહીં.

સમયનો સદુપયોગ પણ માણસ જ કરી શકે છે. સમય અખંડ વહેતો પ્રવાહ છે. અખંડ છે. માણસે તેને ખંડ ખંડમાં વહેંચી દીધો છે. સમયનો એક નાનકડો સ્ક્રુ પણ જો વેડફાય - ખોટવાય તો ઘણો મોટો નફો ગુમાવવો પડે છે. સમયની બલિહારી છે. જે સમયને ઓળખે છે, જે સમયને જાણે છે તે સફળ સંસારી છે.

એક એક શ્વાસ સમયાધિન છે, છતાં માણસ નિરંકુશ રીતે સમયને ઓળંગવા (ઓવરટેઈક) કરવા પ્રયત્ન કરે છે.

ક્યારેક ગડથોલુ ખાઈ જાય છે અને દુઃખી થાય

છે 'સમય અને સમુદ્રનાં મોજા કોઈની રાહ જોતા નથી' જે ક્ષણે, વહેતા પાણીમાં હાથ બોળીને ચાખી લો એટલુ પાણી આપણુ. જીંદગીનું નામ જ વહેતુ ઝરણું છે.

આશા, અરમાન, સ્વપ્ન ને સિધ્ધ કરવા સમયની સાથે કદમ મિલાવવા જોઈએ. સમયને પગ તળે ચગદીને, સમયને ભીસીને, સમયને દળીને, સમયને ઢસડીને, સમયને ખેંચીને કે સમયને પાછળ ઠેલીને ક્યારેય જીવનના સુખ-સ્વપ્નો સિધ્ધ કરી શકાતા નથી અને સુખ - સ્વપ્ન સિધ્ધ થાય તો આયુષ્યનો આંક પુરો થાય છે. નિરાંતે, એકાંતે કે રાતે સમય સાથે ગોષ્ઠિ કરી લેવી જોઈએ. સમયને મિત્ર બનાવીને ગુફ્તેગુ કરી લેવી, સમય તમને સમજ આપશે, સમય તમને સાથ આપશે, સમય તમને સફળતા આપશે.

સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લુંટીયો વહી ધનુષ વહી બાન.

અર્જુન ફરતી માછલીની આંખ વીધી શકે પણ ક્ષણને હણી ન શકે. સમયને કોણી મારીને આગળ જવામાં તો અકસ્માત જ થાય.

સાભાર - જીવનની સુખમય ક્ષણો

અભિમાન, ક્રોધ, પ્રમાદ, રોગ, આળસ આ પાંચ કારણોથી મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થતુ નથી

પુષ્પાબેન મહેતા (૧૯૦૫ થી ૧૯૮૮)

પુષ્પાબેનના પિતા જંગલમાં અધિકારી હોવાથી એવા ગામોમાં રહેવું પડતું જ્યાં શાળા ન હોય પરંતુ તેમના માતા પિતાએ તેમને ઘરે જ ઈતિહાસ-ભુગોળ અને સામાજિક પરીસ્થિતિનું શિક્ષણ આપ્યું. તેમના માતા હેતુબા સાહસી હતા. સાસરીયાનાં ત્રાસથી ઘણી સ્ત્રીઓ તેમની પાસે આવતી તેમને તેઓ આશ્રય આપતા. ઘણી વાર આ બહેનો ત્રાસના કારણે પાછી સાસરે જવા તૈયાર ન હોય ત્યારે તેમને સમજાવી પાછી મોકલતા ત્યારે પુષ્પા પુછતી તું આને પછી કેમ મોકલે છે ? આપણા ઘરે કેમ નથી રાખતી ? ત્યારે માતા તેને કહેતી કે હું તેમ ન કરી શકું પણ તું મોટી થઈને એવું કરજે.

૧૪ વર્ષની ઉંમરે શિક્ષક જનાર્દન મહેતા સાથે તેમના લગ્ન થયા અને અધુરો અભ્યાસ સાથે શરૂ થયો. ૨૫ વર્ષની ઉંમરે વિધવા થયા.

૧૯૩૪માં અમદાવાદમાં શિક્ષિકા તરીકે જોડાયા પરંતુ તે જ વર્ષે તેમની મુલાકાત મૃદુલાબહેન સાથે થઈ અને પુષ્પાબહેનને જીવનની દિશા મળી ગઈ જયોતિસંઘમાં જોડાઈ તેમણે બહેનોને શિક્ષણ માટેના વર્ગો ચલાવ્યા. આવમાં ખબર મળી કે કેટલાક માથાભારે માણસો ગરીબ મજૂરોને ધીરેલા પૈસા પરત ન મળે તો તેમની સ્ત્રીઓને ઉઠાવી જાય છે તેમની સામે પોલીસ પણ કાંઈ કરતી નથી પુષ્પાબહેન તેમની ખોલીમાંથી જઈને સ્ત્રીઓને છોડાવી લાવ્યા.

આ નીડરતાની વાત વાયુ વેગે પ્રસરી ગઈ અને અનેક દુઃખી સ્ત્રીઓ તેમની પાસે મદદ માટે આવવા માંડી. આ સ્ત્રીઓને આશ્રય આપવા ૧૯૩૭માં પુષ્પાબહેને વિકાસ ગૃહની શરૂઆત કરી. જ્યાં સ્ત્રીઓને આશ્રય જ નહીં, વિકાસની તકો પણ મળતી. ત્યાર બાદ સૌરાષ્ટ્રનાં અનેક સ્થળોએ કેટલીક સંસ્થાઓની સ્થાપના માટે તેઓએ પહેલ કરી.

૧૯૪૨ની લડતમાં વિકાસ ગૃહ ભુગર્ભમાં રહેતા કાર્યકરોનું આશ્રય સ્થાન અને મીટીંગ સ્થાન બન્યું. આઝાદી પછી જુનાગઢનાં નવાબના પાકીસ્તાન સાથે જોડાવાના નિર્ણય સામે સ્થપાયેલ આરજી હકુમતના તેઓ પ્રધાન બન્યા અને જ્યારે જુનાગઢ હિન્દ સંઘ સાથે જોડાયું પછી ત્યાં ફાટી નીકળેલ કોમી રમખાણોમાં લતે લતે ફરી લોકોને શાંત કર્યા.

પાટણમાં સુર્યમંદિર અને મસ્જિદનો વિવાદ થયો ત્યારે તેમણે રસ્તો કાઢ્યો કે ત્યાં મ્યુઝિયમ થાય. આજે પણ આ સ્થળે મ્યુઝિયમ છે.

સેન્ટ્રલ તથા રાજ્ય સોશ્યલ વેલફેર બોર્ડનાં અધ્યક્ષ બન્યા. સ્ત્રીઓ અને બાળકો માટે અનેક કલ્યાણ યોજનાઓ બનાવી. સ્ત્રીઓના અપમૃત્યુ નિવારવા આપઘાત સમીતીની રચના કરી. ગર્ભપાત કાયદેસર કરવા માટે તેમણે ૧૯૬૦માં એક નિબંધ તૈયાર કરેલ. ૧૯૮૭માં મૃત્યુ પામ્યા ત્યાં સુધી સતત સ્ત્રીઓના કલ્યાણ માટે કાર્યરત રહ્યા.

આપણે આપણા ડર સિવાય બીજા કશાથી ડરવાની જરૂર નથી.

ટીમ મીટીંગ

તા.૧૨, ૧૩ તથા ૧૪ માર્ચ ૨૦૧૦ દરમ્યાન શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર તથા હરીરાજ ચેરીટેબલ ટ્રસ્ટનાં કાર્યકરોએ ત્રણ દિવસીય બેઠક યોજી હતી. આગળની મીટીંગની કાર્યવાહીની નોંધ વાંચવામાં આવી જેમાં કાર્યકરોનાં સુચન, મુશ્કેલી, આયોજન, વિગેરે મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી. તેમજ સંસ્થાના વિઝન મિશનને ધ્યાનમાં રાખી તે અંગે સંસ્થાએ હવે આવતા સમયગાળા દરમ્યાન સંસ્થામાં કેવી કામગીરી કરવી જોઈએ તેના પર ચર્ચા કરવામાં આવી. હરિરાજ દ્વારા ચાલતી પ્રવૃત્તિઓ જેમાં ૬૦ SHGs બન્યા છે. કૌશલ્ય વિકાસ કાર્યક્રમના બ્યુટી પાર્લર કોર્ષની ૨ મહીનાની તાલીમ ૩૦ બહેનોને આપી. નમક આવાસ હેઠળ ૨૧ શેલ્ટર વિગેરે થયેલ કામગીરીને ધ્યાનમાં લઈ આગામી ૨૦૧૦ – ૧૧ માટે આયોજન કર્યું હતું.

કાર્યકરો જે સંસ્થામાં જોડાયેલા છે તે તેના વિશે કેટલી જાણકારી ધરાવે છે તે જાણવા માટે એક તૈયાર કરેલ પ્રશ્નાવલીમાં વિગતો ભરવા આપી.તેનું વિશ્લેષણ કરતાં જાણવા મળ્યું કે મોટા ભાગના સાથીઓ પોતાની સંસ્થા વિશે જાણકારી રાખવા તથા તેને અદ્યતન બનાવવા ઉદાસીન હતા.

રોજબરોજમાં ઉપયોગમાં લેવાતી બાબતો જેવી નિયમિતતા, શિસ્ત, નિયમોનું પાલન તથા અન્ય સારી પરંપરાઓ બાબતે એક પ્રશ્નાવલીમાં

આવેલ જવાબોથી જાણવા મળ્યું કે મોટા ભાગના સાથીઓને આ બધી બાબતો પ્રેક્ટીસમાં લેવી ગમે છે.

આ ઉપરાંત સેલ્ફ ઈવેલ્યુએશન, ટાઈમ ટ્રાયલ ઈમ્પોરટન્સ વિગેરે જેવી બાબતો જે દરેક કામ માટે ઉપયોગી બને તેવા મુદ્દા ઉપર સમજ બનાવવામાં આવી.

કામની સમીક્ષા દરમ્યાન એક ગામેથી બીજા ગામે જવામાં, જંગલનો બેઠક લાઈન સર્વે કરવા તેમજ રોજબરોજના કાર્યોમાં પડતી મુશ્કેલી ઉપર કાર્યકરોની સમજ બને તે માટે જરૂરી ઉદાહરણો સાથે લાંબી ચર્ચા ચાલી.

પછીના દિવસે ફીલ્ડવીજીટ માટે જવાનું હોય તે અંગે આયોજન કર્યું હતું. જેમાં ખાંભા તાલુકાના ધાવડીયા તથા ભાડ ગામે જઈ ત્યાં લોકો પાસેથી માહિતી મેળવવા અંગેની વિગતો તૈયાર કરવામાં આવી.

ધાવડીયા ગામે ગામના મંડળના પ્રમુખ તથા મંત્રીને મળ્યા તેમની શાસન તથા દફતરી વ્યવસ્થા જોઈ. ગામના લોકો સાથે યોજનામાં લોકોની ભાગીદારી બાબતે સંવાદ થયો. ઈકો ડેવલપમેન્ટ કમિટીના પ્રમુખશ્રીને પણ મળ્યા તેમના દ્વારા થયેલ વિકાસ કામો અને પડેલ મુશ્કેલીઓની વિગતો જાણી.

બપોરબાદ ભાડ ગામે થયેલ લોકભાગીદારીથી થયેલા વિકાસ કામો સ્થળ ઉપર જોઈ રાત્રે ગામ લોકો સાથે ચર્ચા કરી હતી.

માનવીનો સાચો મિત્ર એની દશ આંગળીઓ છે.

Lets discuss today history of GM crops. Genetically modified (GM) foods are foods derived from genetically modified organisms. Genetically modified organisms have had specific changes introduced into their DNA by genetic engineering, using a process of either Cisgenesis or Transgenesis. These techniques are much more precise than mutagenesis (mutation breeding) where an organism is exposed to radiation or chemicals to create a non-specific but stable change. Other techniques by which humans modify food organisms include selective breeding (plant breeding and animal breeding), and somaclonal variation.

GM foods were first put on the market in the early 1990s. Typically, genetically modified foods are transgenic plant products: soybean, corn, canola, and cotton seed oil. But animal products have also been developed. In 2006 a pig was controversially engineered to produce omega-3 fatty acids through the expression of a

roundworm gene. Researchers have also developed a genetically - modified breed of pigs that are able to absorb plant phosphorus more efficiently, and as a consequence the phosphorus content of their manure is reduced by as much as 60%. Critics have objected to GM foods on several grounds, including perceived safety issues, ecological concerns, and economic concerns raised by the fact that these organisms are subject to intellectual property law.

Method

Genetic modification involves the insertion or deletion of genes. In the process of Cisgenesis genes are artificially transferred between organisms that could be conventionally bred. In the process of Transgenesis genes from a different species are inserted, which is a form of horizontal gene transfer. In nature this can occur when exogenous DNA penetrates the cell membrane for any reason. To do this artificially may require attaching genes to a virus or just physically inserting the extra DNA

માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા તપાસવી પડે છે.

into the nucleus of the intended host with a very small syringe, or with very small particles fired from a gene gun. However, other methods exploit natural forms of gene transfer, such as the ability of *Agrobacterium* to transfer genetic material to plants, and the ability of lentiviruses to transfer genes to animal cells.

Development

The first commercially grown genetically modified whole food crop was a tomato (called FlavrSavr), which was modified to ripen without softening, by a Californian subsidiary of Monsanto called Calgene. Calgene took the initiative to obtain FDA approval for its release in 1994 without any special labeling, although legally no such approval was required. It was welcomed by consumers who purchased the fruit at a substantial premium over the price of regular tomatoes.

However, production problems and competition from a conventionally bred, longer shelf-life variety prevented the product from

becoming profitable. A variant of the Flavr Savr was used by Zeneca to produce tomato paste which was sold in Europe during the summer of 1996. The labeling and pricing were designed as a marketing experiment, which proved, at the time, that European consumers would accept genetically engineered foods. Currently, there are a number of food species in which a genetically modified version exists.

Hawaiian papaya Variety is resistant to the papaya ringspot virus. There is New gene added/transferred into plant genome 50 %.

Cotton (cottonseed oil) Pest - resistant cotton Bt crystal protein gene added/transferred into plant genome its 83%.

These are the basic information which came from internet. All of you know that nowadays our government tried to gave permission to GM bringle but it was not done. We have to think that GM crops is useful to us or dangerous to us and environment around us.

Bharat Vala

જેણે સહન કરેલું નથી, તે સાચું સુખ જાણતા નથી.

૨૧ માર્ચ વિશ્વ વન દિવસ

સમગ્ર વિશ્વમાં વનોનું મોટા પાયે ઉન્મુલન થઈ રહ્યું છે વિશ્વમાંથી પ્રતિ મીનીટે ૧૦૦ એકર જેટલા વિષુવવૃત્તિય જંગલોનો વિનાશ થતો રહ્યો છે. આ વનોમાં વનસ્પતિની વિવિધતાની સાથે તેમાં રહેતી પ્રાણી સૃષ્ટિની વિવિધતા પણ નષ્ટ થતી જાય છે. વનોનો કૃષિ વિષયક ઉપયોગ, ખાણો, માર્ગો, રેલ્વે, સિંચાઈ એમ અનેક ઉપયોગો માટે વિનાશ થતો રહ્યો છે. વનોની આસપાસ રહેતા લોકો કે જે વનો ઉપર નિર્ભર રહે છે અને તેમનામાં કેટલાક નિરંતર વૃક્ષો કાપી વનોનો વિનાશ કરતા હોય છે. દુનિયાના તમામ વનો ઉપર આ પ્રકારનાં સંકટો ઉભા થયેલા છે ઔદ્યોગીકીકરણ, કૃષિ, ખાણ ખોદકામ જેવી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓના કારણે વનો ઉપર સતત જોખમ ઉભુ થયેલું છે. વૃક્ષો અને વનસ્પતિ તમામ સજીવો માટે પાયાની જરૂરીયાત પુરી પાડે છે. વનો થકી ખેતી સમૃદ્ધ બને છે. વનો સુર્યપ્રકાશની ગરમીનું શોષણ કરે છે અને હવામાન શીતળ રાખે છે. વનો છે તેથી વરસાદ આવે છે. વૃક્ષોની ઘટા વરસાદની ઝાપટનો માર જીલી લઈ વરસાદનો વેગ તોડી નાખે છે જેથી માટીનું ધોવાણ થતું અટકે છે વનો વરસાદના પાણીને જમીનમાં ઉતારતા હોવાથી સંગ્રહ થયેલ પાણી ઝરણા સ્વરૂપે નદીઓમાં વહેવા લાગે છે. વનો ઝરણા, નદી વગેરેનો પ્રવાહ જાળવી રાખવામાં

અંત્યત ઉપયોગી છે. ઘણાં વૃક્ષો ઔષધીય ગુણો ધરાવતા હોય છે. દરેક વૃક્ષ એ એક સ્વતંત્ર કારખાનું છે એટલે કદાચ અંગ્રેજીમાં તેને PLANT કહેલ છે. મનુષ્યને કારખાનું ઉભું કરવામાં ઘણી જ મુડીની જરૂર રહે છે પરંતુ આ કારખાનું વગર ખર્ચે સ્થાપી શકાય છે. માણસ પોતાની જરૂરીયાત માટે વનોનો નાશ કરી રહ્યો છે. આ વિનાશને અટકાવવા માટે આપણી પાસે વિશાળ જનમત ઉભો કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બાકી રહેતો નથી વનોના પ્રશ્નો કાયદાના અભાવે નહીં પરંતુ અસરકારક અમલના અભાવે ઉભા થઈ રહ્યા છે. તેથી વૃક્ષોનું વાવેતર કરી આપણે સમાજમાં એક સંદેશો પહોંચાડીએ. આપણી જીવન શૈલીથી આપણા પર્યાવરણ ઉપર અસર થાય છે તેથી વનોનું મહત્વ સમજી વૃક્ષોનું વાવેતર કરવાનો નિર્ણય લેવો જરૂરી છે. અને વધારે વૃક્ષો વાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને આપણી પ્રકૃતિનો આદર કરવો જોઈએ અને તેની જાળવણી કરવી જોઈએ. વનોની જાળવણીનાં સંકલ્પરૂપે તા.૨૭ માર્ચનાં રોજ લીલાવતી શાળાની ૧૦ વિદ્યાર્થીઓ સાથે પેપર રીસાયકલ તાલીમ યોજી જેમાં કાગળોનો કરકસરયુક્ત વપરાશ અને તેનાં ફરીવાર ઉપયોગથી કેટલા વૃક્ષો બચાવી શકાય તે સમજ લોકો સુધી લઈ જવા વિદ્યાર્થીઓ સંકલ્પ બદ્ધ થયા.

દુર્જનતા સામે સજ્જનતા હંમેશા જીતે છે.

કોઈ કોઈનું નથી

૬૫ વર્ષનાં એક માજી રડતાં રડતાં શનિવારે ૩ વાગ્યે મહિલા ન્યાય સમીતીનાં બહેનો પાસે આવ્યા રડવાનું બંધ થાય નહીં ચંપાબેને તેમને પાણી આપ્યું શાંત પાડ્યા અને તેમની વાત નિઃસંકોચ જણાવવા કહ્યું.

માજીનું હૈયું શાંત થતા તેમણે કહ્યું મારા ઉપર તથા મારી દીકરીનું દુઃખ જોવાતું નથી મારી દીકરીનાં લગ્ન આજથી ૧૭ વર્ષ પહેલા થયા હતા ૧૫ વર્ષનાં ઘર સંસાર ના સુખમય જીવન દરમ્યાન તેમને ૨ પુત્ર તથા ૧ પુત્રી થયા. ૧૫ વર્ષ શહેરમાં સુખમય જીવન વિત્યું છેલ્લા બે વર્ષથી મારી દિકરીનું મગજ અસ્થિર થઈ જતા જમાઈ આવીને મુકી ગયા હતા. તે તેડવા ન આવતા મારી દિકરીની માનસીક પરીસ્થિતી વધારે બગડી ગઈ. ગમે તેને ગમે તે મારી લેવું, ગાળો દેવી, તોડફોડ કરવી, જેવી પ્રવૃત્તિઓ વધી ગઈ જેથી તેમને સાંકળથી બાંધી ઘરમાં પુરી રાખવી પડે છે. શરૂઆતમાં અમે તેને સારી રીતે રાખી. હવે અમારા બન્નેની ઉંમર વધી ગઈ હું ગામના વાસણ સાફ કરી ગુજરાન ચલાવું, મારા પતિ બિમાર અને ખાટલા વશ છે હવે અમારે શું કરવું ? ક્યાં જવું? આ દિકરીનું શું કરવું ?

માજીની વાત સાંભળી બધાને ખુબ દુઃખ થયું માજીને જણાવ્યુંકે તમારી દિકરીની જવાબદારી

તેમના પતિની છે માટે તેમને ફોન કરી પત્નિને પોતાની સાથે રાખે તે માટે અને તેની સારવાર કરવા જણાવ્યું પરંતુ તેઓ આવ્યા નહીં, તેમના વતનના ગામનાં સરપંચને ઉપરોક્ત વાત કરી સમજાવવા જણાવ્યું પરંતુ તેમાં પણ સફળતા મળી નહીં. આખરે માજીને જણાવ્યું કે, તમારા જ્ઞાતિનાં આગેવાનોને બોલાવો અને ચર્ચા કરીએ પણ આગેવાનો આગળ આવવા તૈયાર ન થયા. અંતે બહેનને સારવાર અર્થે મોકલવા નિર્ણય થયો.

માસ દરમ્યાન થયેલ કામગીરી

૨/૩	જેન્ડર અંગે તાલીમ —રાજકોટ
૬/	વર્ષા વિમા અંગે રાજ્ય કક્ષાની કાર્યશાળા — અમદાવાદ
૮/	મહિલા દિન ઉજવણી—અમદાવાદ
૧૧/૧૨	પ્રેરણા પ્રવાસ (પશુ પાલન) અમદાવાદ
૧૧/	એલ.આઈ.સી. મીટીંગ — જાફરાબાદ
૧૨/૧૩/૧૪	ટીમ મીટીંગ— અમરેલી
૧૫/	એસકેવાવ કોર ટીમ મીટીંગ—રાજકોટ
૨૨/૨૬	ડીઝાસ્ટર રીસ્ક રીડકશન—અમદાવાદ
૨૫/	એસકેવાવ બજેટ મીટીંગ—અમદાવાદ
૨૭/	પેપર રીસાયકલ ટ્રેનીંગ —અમરેલી
૨૭/	કારોબારી મીટીંગ— અમરેલી
૨૮/	અવિરત બોર્ડ મીટીંગ —ખાંભા

અહંકાર રૂપી વાદળા ખસી જશે તો ચૈતન્ય રૂપી સુર્યનાં દર્શન થશે.

યુવા ઈવેન્ટ

સ્ત્રીઓ પર થતી હિંસા તેમજ એકલનારીને પડતી મુશ્કેલીઓને રોકવા માટે સંસ્થા દ્વારા અમરેલી જિલ્લાનાં ખાંભા ગામે હનુમાનગાળા ખાતે તા. ૨૮/૨/૨૦૧૦ નાં રોજ યુવા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બાબતે આજના યુવાનો સંવેદનશીલ બને તેમજ ટેકાડૂપી ભુમિકા ભજવતા થાય અને સ્ત્રીઓની મુશ્કેલી તેમજ તેમના પ્રશ્નોને સમજે તેમજ યુવાઓ સામાજિક મુદ્દા પર ચર્ચા કરે તેમજ નડતા પ્રશ્નો પર નિરાકરણ માટે આયોજન કરે તે હેતુને ધ્યાનમાં લઈ યુવા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

આ યુવા ઈવેન્ટમાં સંગઠન અને શાસન

વ્યવસ્થા, કયા કયા અધિકારો સ્ત્રીઓને મળે છે, શિક્ષણ, સ્વાસ્થ્ય, સમાનતા વિગેરે જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ યુવા ઈવેન્ટમાં ધીરુભાઈ વાગડીયા, પ્રો. જયંતિભાઈ તળાવીયા, સુરેશભાઈ ગોહીલ, જીજ્ઞાબેન જોષી, પ્રમોદભાઈ જોષી, અશોકભાઈ શેલાર, વિપુલભાઈ શેલડીયા, વિજયાબેન, દયા જાદવ, ડાહ્યાભાઈ પટેલ વિગેરેએ હાજરી આપી હતી.

આ યુવા ઈવેન્ટમાં કોથળા દોડ, વાર્તા, તેમજ બીજી રમતો દ્વારા યુવાનોને સ્ત્રીઓની મુશ્કેલીઓ તેમજ પ્રશ્નોનું નિરાકરણ મળે તેવી સમજ આપવામાં આવી હતી.

માહિતી અધિકાર હેલ્પલાઈન : ૯૯૨૪૦૮૫૦૦૦

Printed, published and edited by Hardik Dhirajlal Vagadia on behalf of Educational & Social Welfare Centre, Published from Tapak Karyalay, 26-Omnagar-3, Hanumanpara Road, Amreli and printed at Geeta Graphics, F-1 Sahjanand market, Station road, Amreli.

Post Reg. No. L2/41/G-AMI-91/2008
Valid Upto 31/12/2011

RNI No. GUJGUJ/1999/01521
Date Of Issue 1st of month

Book -Post, Printed Matter



ટપક કાર્યાલય :

શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર,
૨૬, ઓમનગર (૩), હનુમાનપરા રોડ,
ગોકુલ પાર્ક સામે, અમરેલી-૩૬૫ ૬૦૧.

Tel/Fax : 02792-223525

E-mail : tapak@sskkamreli.org website: www.sskkamreli.org

સારા દેખાવા કરતા સારા થવાનો પ્રયત્ન માણસને વધારે ઉંચે લઈ જાય છે.